

نَعِيمُ الْمُنَاجَاةِ الرَّمَضَانِيَّةِ

١١٣٧

١٣١

١٧٠

١٤٣٨ هـ

أُنَاجِي إِلَهَ الْعَرْشِ جَلَّ جَلَالُهُ

مُنَاجَاةٌ صَنَّفَهَا

الدَّاعِي الْأَجَلُ الْفَاطِمِي

سَيِّدُنَا وَمَوْلَانَا أَبُو خَزِيمَةَ طَاهِرُ نَخْرِ الدِّينِ طَع

سنة ١٤٣٨ هـ

نَسِيمٌ فَيُوضِ الْمُنَاجَاةِ الطَّاهِرَةِ

٢٥١

١٣١

٨٩٦

١٦٠

١٤٣٨ هـ

نَعِيمٌ الْمُنَاجَاةِ الرَّمَضَانِيَّةِ

١١٣٧

١٣١

١٧٠

١٤٣٨ هـ

يَنْبُوعُ فَيُوضِ لَيْلَةِ الْقَدْرِ

٣٣٥

٧٥

٨٩٠

١٣٨

١٤٣٨ هـ

المناجاة الشريفة

أَنَا جِي إِلَهَ الْعَرْشِ جَلَّ جَلَالُهُ

صنّفها

الدّاعي الأجلّ الفاطميّ

سيدنا ومولانا أبو خزيمة طاهر نخر الدين طع

في ليلة القدر

سنة ١٤٣٨ هـ

Published by the Office of the 54th Dai al-Mutlaq His Holiness Syedna Taher Fakhruddin TUS

**Saifee Mahal,
A.G. Bell Road, Malabar Hill, Mumbai 400 006**

**Darus Sakina
Pokhran Rd. No. 1, Upvan, Thane (W) 400 606**

Ramadan al-Mo'azzam 1438H

JUNE 2017

© Fatemidawat.com

بِسْمِ الرَّحْمَنِ الرَّحِيمِ .

۱ أَنَا جِي إِلَهَ الْعَرْشِ جَلَّ جَلَالُهُ
وَأَدْعُو رَحِيمَ الْخَلْقِ عَمَّ نَوَالُهُ

अर्श ना साहेब, जलाल अने अजमत ना साहेब, ने में मुनाजात करूं छुं,
भल्क ने रेहमत करनार, जे नी नवाजिश सगला पर आम छे, अने दोगा करूं छुं,
अर्श ना साहेब, जलाल अने अजमत ना साहेब, ने में मुनाजात करू छुं
खल्क ने रेहमत करनार, जेनी नवाजिश सगला पर आम छे, एहने दोगा
करू छुं.

۲ أَنَا جِيكَ يَا اللَّهُ رَبِّي خَاشِعًا
مُنَاجَاةً مَمْلُوكٍ عَلَيْكَ أَيْكَالَهُ

तने भुशुं ना साथे मुनाजात करूं छुं अे अछाह, अे मारा रब,
में तारो ममलूक छुं, तारा उपर मारो तवक्कुल छे,
तने खुशू ना साथे मुनाजात करू छुं ऐ अल्लाह, ऐ मारा रब,
में तारो ममलूक छुं, तारा ऊपर मारो तवक्कुल छे.

۳ أَنَا جِيكَ رَبِّي عَابِدًا مُتَّبِعًا

مُنَاجَاةَ مَكْرُوبٍ لَدَيْكَ سُؤَالُهُ

तारी अंदगी करता हुआ, तबत्तुल करता हुआ तने मुनाजात करुं छुं,
में कुरबत मेहनत मां छुं, तारा दर पर सवाल करुं छुं,

तारी बंदगी करता हुआ, तबत्तुल करता हुआ तने मुनाजात करुं छुं,
में कुर्बत मेहनत मां छुं, तारा दर पर सुआल करुं छुं.

۴ إِلَهِي أَرْحَمَنُ عَبْدًا آتَاكَ مُؤَمَّلًا
إِلَيْكَ لِنَيْلِ السُّؤْلِ أُمَّ رِحَالُهُ

એ પરવરદિગાર તારા અંદા ને રેહમત કર, જે તારા નઝદીક ઉમ્મીદ કરતા હુઆ આયો છે,
ઉમ્મીદ પૂરી કરવા ને તારા દર પર એના ઉમ્મીદ ના બારકશ એ કસ્દ કીધો છે,
એ પરવરદિગાર તારા બંદા ને રેહમત કર, જે તારા નઝદીક ઉમ્મીદ કરતા
હુઆ આયો છે,
ઉમ્મીદોં પૂરી કરવાને તારા દર પર એના ઉમ્મીદ ના બારકશ એ કસ્દ કીધો
છે.

۵ بِبَابِكَ عَبْدٌ خَائِفٌ بَائِسٌ وَمَا
لَهُ مَكْرَمَاتٍ بَلْ قَبَاحٌ فِعَالُهُ

તારા દર પર એક ગુલામ, ફકીર, ખૌફ માં ખડો છું,
કોઈ ખૈર નું અમલ નથી, બલકે સગલા અમલ કિબાહ છે,
તારા દર પર એક ગુલામ, ફકીર, ખૌફ માં ખડો છું,
કોઈ ખૈર નું અમલ નથી, બલકે સગલા અમલ કિબાહ છે,

٦ بِبَابِكَ عَبْدٌ مُفْرَطٌ مُذْنِبٌ هَوَاً -
- هُ أَنْسَاهُ خَوْفَ الْإِثْمِ ذَلِكَ حَالُهُ

તારા દર પર એક હદ તજાવુજ કરનાર ગુનેહગાર બંદો ખડો છે,
એની હવા નફૂસી એ એને ગુનાહો નો ખોફ ભુલાવી દીધો છે,
तारा दर पर एक हद्द तजावुज करनार गुनेहगार बंदो खडो छुं,
एहनी हवा-नफूसी ये एहने गुनाहों नो खौफ भुलावी दीधो छे.

٧ وَذَنْبِي كَثِيرٌ فَأَعْفُ عَنِّي إِلَهِنَا
أَمْوْتُ حَيَاءً لَوْ تَرَأَى نَكَالَهُ

મારા ગુનાહ ઘણા છે એ પરવરદિગાર, તું મને માફ કરી દે,
અગર એ ગુનાહો નો ખમીયાજો સામને આવે તો મને શરમ સી મૌત આવી જાય,
मारा गुनाहों घना छे ऐ परवरदिगार, तू मने माफ करी दे,
अगर ये गुनाहों नो खमियाजो सामने आवे तो मने शर्म सी मौत आवी
जाई

٨ بِلَيْلَةٍ قَدْرِ فَاطِمَ الطُّهْرِ فَأَغْفِرْ
عُبَيْدًا لَدَى رَبِّ الْبَرَايَا أَبْتِهَالَهُ

લૈલતુલકદર માં એના મમસૂલ ફાતેમા ની હુરમત સી આ ગુલામ ને તું બખ્શી દે,
તારી બારગાહ માં એ પરવરદિગાર એ ઇબ્તિહાલ કરે છે, ઇલ્તિજા કરે છે,
लैलतुल कदर मा एहना मम्सूल फातेमतुत तोह नी हुरमत सी आ
गुलाम ने तू बखशी दे,
तारी बारगाह मा ऐ परवरदिगार ये इब्तिहाल करे छे, इल्तिजा करे छे.

٩ بَغِيرِ حِسَابٍ وَأَرْزُقِ الْعَبْدَ مُنْعِمًا

عَلَيْهِ بِلُطْفٍ مَا يَكُونُ حَلَالَهُ

તારા ગુલામ ને તારા લુત્ફો કરમ સી બે-ગૈરે હિસાબ
બેશુમાર હલાલ ની રોઝી અતા કરી દે,

તારા ગુલામ ને તારા લુત્ફો કરમ સી બે-ગૈરે હિસાબ,
બે-શુમાર હલાલ ની રોઝી અતા કરી દે.

١٠ وَأَنْعِمِ عَلَيْهِ نِعْمَةً إِثْرَ نِعْمَةٍ

فَإِحْسَانُ رَبِّي لَأَيَكُونُ زَوَالَهُ

એક પછી એક નેમત સી એને નવાઝી દે,
એ પરવરદિગાર તારા એહસાન નું કોઈ ઝવાલ નથી, ઇન્તેહા નથી,

એક પછી એક નેમત સી એને નવાઝી દે,
એ પરવરદિગાર તારુ એહસાન નુ કોઈ ઝવાલ નથી, ઇંતિહા નથી.

١١ بِزِينَةِ عِلْمِ الْحَقِّ يَا رَبَّنَا كَذًا

بِأَحْسَنِ أَخْلَاقٍ يَكُونُ جَمَالَهُ

હક ના ઇલ્મ ની ઝીનત સી, અને નેક અખલાક ના જમાલ સી,
એ પરવરદિગાર તું મને ઝીનતદાર કર,

હક ના ઇલ્મ ની ઝીનત સી, અને નેક અખલાક ના જમાલ સી,
એ પરવરદિગાર તૂ મને ઝીનતદાર કર.

۱۲ وَهَبَهُ إِلَهِي قُرَّةَ الْعَيْنِ فِي الْبَيْتِ
نَ فِي نِعْمَةٍ دَابًّا يَعِيشُ عِيَالَهُ

એ પરવરદિગાર મારા ફરઝંદો માં મારી આંખ ઠંડી કર,
મારા એહેલો અયાલ હમેશા નેઅમત માં રહે,

ऐ परवरदिगार मारा फर्ज़न्दों मा मारी आँख ठंडी कर,
मारा एहेलो एयाल हमेशा नेअमत मा रहे.

۱۳ وَفَاتِحَةً بِالْخَيْرِ كَانَ أِبْتِدَاءَهُ
كَذَلِكَ رَجْوَاهُ يَكُونُ مَالَهُ

એ પરવરદિગાર તું એ મારું આગાઝ ઘણું બેહતર કીધું, ખૈર ફાતેહત કીધું,
એજ મિસલ ઉમ્મીદ કરું છું કે મારો અંજામ, ખૈર અંજામ કરજે,

ऐ परवरदिगार तू ये मारु आगाज़ घनु बेहतर कीधू, खैर फातेहत कीधू,
एज मिसल उम्मीद करू छुं के मारो अंजाम, खैर अंजाम करजे.

۱۴ وَبَارِكْ لِمَنْ آدَى الزَّكَاةَ مَعَ الصَّدَا
وَةٍ يَنْمُو لَهُ فِي مَتَجَرِّ الرِّبْحِ مَالَهُ

એ પરવરદિગાર જે સગલા નમાઝ સાથે ઝકાત ને અદા કરે છે,
એને તું ઘણી બરકત આપજે, નફા-વંતા વેપાર સી એને માલા-માલ કરજે,

ऐ परवरदिगार जे सगला नमाज़ ना साथे ज़कात ने अदा करे छे,
एहने तू घनी बरकत आपजे, नफावंता वेपार सी एहने माला माल करजे.

١٥ بِنَصْرِ عَزِيزِ رَبَّنَا أَفْتَحْ لِعَبْدِكَ الْ
ذِي لِدِفَاعِ الدِّينِ حَقًّا قِتَالَهُ

એ પરવરદિગાર તારા નસ્રે અઝીઝ સી તારા બંદા ને ફતહે મુબીન અતા કરજે,
જે બંદો તારા દીન ની હિમાયત ખાતિર જીહાદ કરે છે,

ऐ परवरदिगार तारा नसरे-अजीज़ सी तारा बंदा ने फतहे-मुबीन अता
करजे,
जे बंदो तारा दीन नी हिमायत खातिर जिहाद करे छे.

١٦ عَدُوَّكَ ذَلَّلَهُ وَأَهْلِكَهُ إِنَّمَا
يُضِلُّ كَثِيرًا مِنْ عِبَادِ ضَلَالَهُ

એ પરવરદિગાર તારા દુશ્મન ને ઝલીલ કરજે, હલાક કરજે,
એની ગુમરાહી ઘણા લોગો ને ગુમરાહ કરે છે,

ऐ परवरदिगार तारा दुश्मन ने ज़लील करजे, हलाक करजे,
एहनी गुमराही घना लोगों ने गुमराह करे छे.

١٧ وَوَفَّقَ لِمَنْ قَدْ كَانَ مِنْ قَبْلُ مُؤْمِنًا
فَتُوصَلَ بِالْحَبْلِ الْمَتِينِ حِبَالَهُ

એ પરવરદિગાર જે પેહલે મુમિન હતા એને તું તૌફીક આપજે,
તાકે હબ્લુલ્લાહિલ મતીન સી, તારા રસ્સા સી એના રસ્સા ને જોડી દે,

ऐ परवरदिगार जे पहले मुमिन हता एहने तू तौफीक आपजे,
ताके हब्लुल्लाहिल मतीन सी, तारा रस्सा सी एहना रस्सा ने जोडी दे.

۱۸ بِحُبِّ بَنِي طَه الرِّضَىٰ وَدُعَاتِهِمْ
لِدِينِي وَاللَّهِ الْعَظِيمِ كَمَالَهُ

તાહા નબી ના ફરજંદો અઈમ્મત ની મોહબ્બત સી, એના દોઆત ની મોહબ્બત સી,
ખુદા ના કસમ મારા દીન નું કમાલ છે,

તાહા નબી ના ફર્જન્દો અઈમ્મત ની મોહબ્બત સી, એના દોઆત ની
મોહબ્બત સી,

ખુદા ન કસમ મારા દીન નુ કમાલ છે.

۱۹ نَبِيِّكَ طَه الْمُصْطَفَىٰ وَوَصِيِّهِ
وَسَائِلُنَا عِنْدَ الدُّعَاءِ وَآلِهِ

તારા નબી તાહા મુસ્તફા, એના વસી, એના ફરજંદો ઇમામો,
એ સગલા નો મેં દોઆ કરતી વક્ત વસીલો લઉં છું,

તારા નબી તાહા મુસ્તફા, એના વસી, એના ફર્જન્દો ઇમામો,
યે સગલા નો મેં દોઆ કરતી વક્ત વસીલો લઉં છું,

۲۰ وَنَوَابِهِمْ مِنْ كُلِّ دَاعٍ مَقَامَهُ
عَظِيمٍ كَامِلًا كَرِيمٍ خِصَالَهُ

યે ઇમામો ના નાઈબો, દોઆત નો વસીલો લઉં છું,
હર એક દાઈ નો મકામ અઝીમ છે, ફરિશ્તા સિફત છે,

યે ઇમામો ના નાઈબો, દોઆત નો વસીલો લઉં છું,
હર એક દાઈ નો મકામ અઝીમ છે, ફરિશ્તા સિફત છે.

۲۱ هُمْ أَوْلِيَاءُ اللَّهِ هُمْ شُفَعَاءُنَا
وَقُطْبُ الْهُدَى مِنْهُمْ عَدِيمٌ مِثَالُهُ

એ દોઆત ખુદા ના અવલિયા છે, હમારી શફાઅત ના કરનાર છે,
અને એ સગલા માં કુત્બુદ્દીન મૌલા અદીમુલ મિસાલ છે, એની મિસલ કોઈ
નથી,

ये दोआत खुदा ना अवलिया છે, हमारी शफाअत न करनार છે,
अने ये सगला मा कुतबुद्दीन मौला अदीमुल मिसाल છે, एहनी
मिसल कोई नथी.

۲۲ فَأَذْكُرُهُ بِالشُّكْرِ فِي كُلِّ لَحْظَةٍ
أَهْلٌ غَابَ عَنَّا بَلْ يَلُوحُ جَلَالُهُ

એ મૌલા ને હર ઘડી હર લહજા યાદ કરું છું, શુકુર કરું છું,
સુ એ આંખો સી ગાયબ થયા છે? ના, બલકે એના જલાલ ની રોશની મારા
આંખો ના સામને છે,

ये मौला ने हर घड़ी हर लहज़ा याद करूँ છું, શુકુર કરૂँ છું,
सु ये आँखों सी गायब थया છે? नहीं, बलके एहना जलाल नी
रोशनी मारा आँखों ना सामने છે.

۲۳ إِلَى جَنَّةِ الْفِرْدَوْسِ كَانَ أَنْتَقَالَهُ
حَنَانًا عَلَيْنَا مِنْ جَنَّاتٍ ظِلَالُهُ

એ મૌલા જન્નતુલ ફિરદોસ ની તરફ સીધારી ગયા,
વહાં સી આપની શફકત હમને સાયો કરે છે,

ये मौला जन्नतुल फिरदौस नी तरफ सिधारी गया,
वहाँ सी आपनी शफकत हमने सायो करे છે.

٢٤ وَنَصَّ عَلَى مَمْلُوكِ آلِ مُحَمَّدٍ
وَذَلِكَ حَبْلٌ لَنْ يَكُونَ انْفِصَالَهُ

આપ એ મમલૂકો આલે મોહમ્મદ પર નસ્સ કીધી,
એ નસ્સ નું હબ્લ, એહનું રસ્સુ, હરગિઝ મુનકતે નહી થાય,

આપયે મમ્લૂકો આલે મોહમ્મદ પર નસ્સ કિધી,
યે નસ્સ નુ હબ્લ, એહનું રસ્સૂ, હરગિઝ મુનકતે નહીં થાઈ.

٢٥ وَنُورُ إِمَامِ الْعَصْرِ بِالْحَقِّ لَامِعٌ
صِيَامِي وَفِطْرِي مِنْهُ وَهُوَ هِلَالُهُ

ઈમામુઝ ઝમાન નું નૂર હક્કન ચમકી રહ્યું છે, એ હકીકી હિલાલ ને દેખી

ને મેં રોઝા કરું છું, ઇફ્તાર કરું છું,

ઇમામુઝ ઝમાન નુ નૂર હક્કન ચમકી રહ્યુ છે, યે હકીકી હિલાલ
ને દેખી ને

મેં રોજા કરુ છું, ઇફ્તાર કરુ છું.

٢٦ أَنَا عَبْدُهُ الْفَادِي عَلَيْهِ بِنَفْسِهِ
بِتَأْيِيدِهِ لِي دَائِمًا اتِّصَالُهُ

મેં એનો ગુલામ છું, એના ઉપર હઝાર જાન સી કુર્બાન છું,
એની તાઇદ મારા સી હમેશા મુત્તસિલ છે,

મેં એનો ગુલામ છું, એના ઉપર હઝાર જાન સી કુર્બાન છું,
એની તાઈદ મારા સી હમેશા મુત્તસિલ છે.

۲۷ وَأَهْدِي جَمِيعَ الْمُؤْمِنِينَ بِفَيْضِهِ
فَقَوْلِي فِي كُلِّ الْأُمُورِ مَقَالَهُ

ઇમામુઝ ઝમાન ના ફૈઝ અને તાઈદ સી મેં મુમેનીન ને હિદાયત દઉં છું,
મારો કૌલ, હર અમર માં, ઇમામ નો કૌલ છે,

इमामुज़ ज़मान ना फैज़ અને ताईद सी में मुमेनीन ने हिदायत दउ
छुं,

મારો કૌલ, હર અમર મા, ઇમામ નો કૌલ છે.

۲۸ وَتَغْشَى صَلَاةَ اللَّهِ طُهُ وَالْآلَةِ
وَنُؤَابِهِمْ مَنْ هُمْ لِصِدْقِ رِجَالِهِ

તાહા નબી ને, આપના ફરઝંદો અઈમ્મત ને, અને અઈમ્મત ના નુવ્વાબ જે
રિજાલે સિદ્ક છે,

એ દોઆતો ને, ખુદા ની સલવાત સાયો કરજો,

ताहा नबी ने, आपना फ़र्ज़न्दों अइम्मत ने અને અઈમ્મત ના નુવ્વાબ
જે રિજાલે સિદ્ક છે,

યે દોઆતો ને, ખુદા ની સલવાત સાયો કરજો.



